

19th June, 2024

To
BSE Limited
Listing Dept. / Dept. of Corporate Services
Phiroze Jeejeebhoy Towers
Dalal Street
Mumbai - 400 001

Security Code : 500101
Security ID : ARVIND

To
National Stock Exchange of India Ltd.
Listing Dept., Exchange Plaza, 5th Floor
Plot No. C/1, G. Block
Bandra-Kurla Complex
Bandra (E)
Mumbai - 400 051

Symbol : ARVIND

Dear Sirs,

Sub.: Newspaper Advertisement – Notice of Postal Ballot & E – Voting Schedule.
Ref.: Regulation 30 and 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

With reference to the captioned subject and in continuation of our intimation dated 18th June, 2024 we send herewith a copy of advertisement published in Financial Express (English & Gujarati) on Wednesday, 19th June, 2024 informing about publication of notice of the Postal Ballot and e-voting information.

You are requested to kindly take the above information on record.

Thanking you,

Yours faithfully,

Krunal Bhatt
Company Secretary

Encl.: As above



BOOST FROM FINCARE SFB MERGER

AU SFB sees robust 25% growth in its vehicle loan book

AJAY RAMANATHAN
Mumbai, June 18

AU SMALL FINANCE BANK expects its vehicle loan book to grow 20-25% in the current financial year.

"With the merger with Fincare Small Finance Bank taking effect in April, we have an opportunity (for growth) in the wheels segment," Bhaskar Karkera, head of retail assets, said. "Traditionally, yields on housing loans are lower, so we want to do more of wheels to balance out growth."

The bank plans to utilise the branch network of Fincare SFB in South India to expand the vehicle loan book. Currently, the bank has a 9% market share in financing Mahindra & Mahindra vehicles and an around 5% market share with Maruti Suzuki.



Merger Gains
AU Small Finance Bank to utilise Fincare SFB's South India network to expand the vehicle loan book

in financing Mahindra & Mahindra vehicles, and 5% in Maruti Suzuki

Overall retail assets of AU Small Finance Bank stood at **₹48,915 crore** as on March 31

Around **63% of advances** are concentrated in Rajasthan, Madhya Pradesh and Maharashtra

The wheels and micro business loan segments constitute nearly **88% of the retail business**

housing loans. The average ticket size of these loans is ₹10 lakh. Around 63% of advances are concentrated in Rajasthan, Madhya Pradesh and Maharashtra.

The wheels and micro business loan segments constitute nearly 88% of the retail business. Around 40% of the

PLI rejig: Faster release of funds, MSME push likely

Only exceptions to quarterly disbursements will be cases where the numbers are small and departments will find it difficult to do so, the sources added. PLI for food processing is one such scheme.

Earlier, the scheme guidelines stated that applications for incentives can be submitted after the end of the financial year to which the claim pertains. Annual claims can be submitted only once and within nine months of the end of the financial year.

It is hoped that quarterly disbursements will speed up payout of incentives because claims are expected to increase this year. The reason for higher claims would be the production starting or increasing in manufacturing units that have qualified for PLI.

Trade policy think tank Global Trade Research Initiative says that currently firms must meet multiple criteria like investments, production, localisation, sales and input types to qualify for the incentives. Many firms are unable to meet production targets to meet this criteria and miss out on incentives, so a review is required.

Even though the government has managed to signifi-



Companies have invested around ₹1.07 trillion in two years through December 2023 under the 14 PLIs, or about 40% of the ₹3 trillion committed

cantly bring down imports of toys with various measures, its attempts to boost their exports haven't succeeded yet. India's toy imports decreased drastically to \$64.1 million in FY24 from \$304.1 million in 2018-19. However, exports saw a modest increase to \$152.34 million in the previous fiscal from \$129.6 million in FY20.

In the extant textiles PLI, selected 64 applicants have cumulatively invested ₹3,317 crore or 17% of their proposed

Two years of Wilson: Air India remains a work in progress

"Being in the service industry, passenger comfort is of the utmost importance, but employees ensure that the standards are maintained, and management ensures that employees are satisfied. Wilson has been able to perform this task well," another executive said.

Many, however, do not agree with that. After all, the AI Express merger saw agitated cabin crew taking sick leave en masse in May, leading to hundreds of flight cancellations over several days. At Vistaar, a stretched roster and unhappy pilots reduced the airline's network capacity by 10% in April this year.

Induction of new aircraft which are a part of the 470 on order has brought a welcome relief to AI's fleet, though the toll of the legacy, a word with which Wilson is apparently unhappy, has had its effect. Other employees whom FE spoke to said that the strain of a legacy carrier, waiting for new equipment and growing expenses have become huge irritants for the top management.

After the merger, the next big project for Wilson is to pilot the setting up of the airline's own engineering centre and training academy. "He does not want to be dependent on any third party, especially where the failure of services is at risk," a third airline employee said. Over the next 18 months, AI hopes to kickstart its in-house line maintenance and set up base maintenance facilities for narrow-body and wide-body aircraft in Bengaluru, in partnership with Singapore Airlines Engineering Company.

The motivation of staying on course for revamping the airline is huge. After all, India is the third largest aviation market in the world by passenger volume, yet it only has a per capita travel of one-fifth that of China. So the upside is tremendous. For the moment, however, Wilson's main job is mostly to maintain a balance between fighting the existing legacy issues and exploiting its tremendous future potential.

TMB submits three names for MD & CEO post to RBI

NARAYANAN V
Chennai, June 18

TAMILNADU MERCANTILE BANK (TMB) has submitted a list of three candidates for the position of MD and CEO to the Reserve Bank of India (RBI) for approval, the lender said in a regulatory filing.

"The bank's board in a meeting held on June 18 has finalised the names of three candidates, in the order of preference, in accordance with the Banking Regulation Act, 1949, and the extant norms prescribed by RBI," it added.

Sources aware of the development said the interview process of the candidates were completed a week before and the names were sent to the regulator for approval. "We expect our regulatory approvals and other formalities to be completed in 45 days," they added.

The development comes after the banking regulator, in April, rejected three candidates proposed by the Tuticorin-head-

BANKING ON

- Interview process of the three candidates got over a week before
- Regulatory approvals, other formalities likely to be done in 45 days
- In April, RBI rejected three candidates proposed by TMB as 'not suitable'
- TMB was struggling to find a successor to former MD & CEO Krishnan, who resigned in September 2023, citing "personal reasons", just a year after his appointment.

quartered bank as "not suitable" and approved a committee of experts (CoE) to oversee its administration and operations earlier this month.

RBI and TMB did not respond to an email query till the date of going to press.

TMB has been struggling to

find a successor to former MD & CEO Krishnan, who resigned in September 2023, citing "personal reasons", just a year after his appointment.

His resignation came in the backdrop of a technical glitch that led to the erroneous credit of ₹9,000 crore into a cab driver's account in September last year. The bank had then said that the mistake was quickly identified, the entries were immediately reversed and strong control measures were put in place.

TMB ran several newspaper advertisements inviting applications for the post of new MD & CEO since Krishnan's resignation was announced. In November last year, it sent three names to RBI for approval, which were rejected in April, forcing the bank to begin the search process again.

Krishnan continued to lead the bank for nine months while awaiting a replacement. However, on June 7, TMB announced that its board had agreed to relieve him of his duties.

Ex-PTC India CMD to move SAT against Sebi order

FORMER PTC INDIA chairman and managing director Rajib Kumar Mishra will move the Securities Appellate Tribunal (SAT) against markets regulator Sebi's order to debar him from being a director in a listed entity for six months.

Following the order passed by Sebi last week, Mishra ceased to be the chairman of PTC India Financial Services (PFS) and CMD of PTC India.

Talking to PTI, Mishra said, "Sebi's order is appealable, and in the merit of the order, I will go to SAT for further action and to safeguard my rights."

PFS, promoted by PTC India, is a non-deposit-taking NDF classified as an infrastructure finance company.

Mishra held office in PFS in the capacity of chairman and non-executive director and was also holding the position of chairman and MD of PTC India.

Pursuant to "regulatory order" issued by Sebi, Rajib Kumar Mishra ceased to be the chairman, non-executive director of the company with effect from the date of issue of the said order i.e. June 12, 2024, PFS had said.

ARVIND LIMITED
(CIN: L1719GJ1931PLC000993)
Regd. Office: Naroda Road, Ahmedabad - 380025.
Phone: 079-68268000, Email: investor@arvind.in, Website: www.arvind.com

NOTICE OF POSTAL BALLOT (THROUGH REMOTE VOTING)

Notice is hereby given, pursuant to the provisions of Section 108, 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 ("the Act"), read together with Rule 20 & 22 of the Companies (Management and Administration) Rules, 2014 ("the Rules") as amended from time to time and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations") and General Circular No. 14/2020 dated 8th April, 2020, latest amended by General Circular No. 69/2023 dated 25th September, 2023 issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars"), Secretarial Standard on General Meetings (SS-2) issued by the Institute of Company Secretaries of India and other applicable laws and regulations, as amended from time to time (including any statutory modification) or re-enactment thereof for the time being in force, that the Company is seeking approval of members for the special business as set out in the postal ballot notice. Members are informed that the Postal Ballot Notice along with relevant Explanatory Statement and e-voting instructions for remote e-voting have been sent only to E-mail and completed on Tuesday, 18th June, 2024 to members who have registered their email addresses with the Company or Depository Participant on their registered e-mail addresses as on the cut-off date i.e. Friday, 14th June, 2024.

The Postal Ballot Notice has been sent to email addresses of those members whose names appeared in the Register of Members / List of Beneficial Owners as received from the National Securities Depository Limited (NSDL) and Central Depository Services (India) Limited (CDSL) on Friday, 14th June, 2024 ("Cut-Off Date"). Accordingly, physical copy of the notice along with postal ballot form and prepaid business reply envelope have not been sent to the members for this postal ballot and members are required to communicate their assent or dissent only through the remote e-voting system. The voting rights shall be reckoned on the paid-up value of the shares registered in the name of members as on the Cut-Off Date who is not a member as on the Cut-Off Date should treat this notice only.

Members whose email addresses were not registered with the Company or Depository Participant(s) as on the Cut-Off Date, are requested to register their email addresses by sending an email citing subject line as "ARVIND - Postal Ballot - Registration of e-mail address" to our RTA i.e. Link Intime India Private Limited at arvind@linkintime.com or to the Company at investor@arvind.in with name of registered shareholder(s), folio number(s) (DP IDs) / Client IDs and No. of shares held to enable them to exercise their vote(s) on the special business as set out in the Postal Ballot Notice through remote e-voting facility provided by NSDL. For details of the manner of casting voting through remote e-voting by the members holding shares in physical form or who have not registered their email addresses with the Company or Depository Participant(s), members are requested to refer instruction no. 7 of the Postal Ballot Notice.

In accordance with the provisions of Section 108 of the Act read with the Rules, the General Circular and Regulation 44 of the SEBI LODR Regulations, the Company is providing facility to its members to exercise their votes electronically in respect of items enlisted in the Postal Ballot Notice through the remote e-voting facility provided by NSDL.

Details of Postal Ballot Schedule:

Sr. No.	Particulars	Schedule
1	Date of Completion of dispatch of postal ballot notice	Tuesday, 18 th June, 2024
2	Cut-off date for identification of voting rights of the members	Friday, 14 th June, 2024
3	Date and time of commencement of remote e-voting	Friday, 21 st June, 2024 (09:00 a.m.)
4	Date and time of end of remote e-voting	Saturday, 20 th July, 2024 (05:00 p.m.)
5	Remote e-voting shall not be allowed beyond	Saturday, 20 th July, 2024 (05:00 p.m.)
6	Scrutinizer	Mr. Hitesh Bach, (CP No.: 8195), Proprietor, Hitesh Bach & Associates, Practising Company Secretaries
7	Contact details of the person in NSDL responsible to address the grievances connected to e-voting	Mr. Pallavi Kulkarni, Manager, email: evoting@nsdl.com or call in Toll free No.: 022-4886 7000 /022-2499 7000

Members are informed that: (1) Members can vote only through remote e-voting facility provided by NSDL as a special ballot form is being deprecated or will be accepted by the Company; (2) A member who has not received Postal Ballot Notice on their registered email address along with relevant Explanatory Statement and e-voting instructions for remote e-voting may obtain the same by sending an email to our RTA i.e. Link Intime India Private Limited at arvind@linkintime.com and to the Company at investor@arvind.in; (3) A copy of the Postal Ballot Notice and the procedure for registration of email addresses of members are also available on the website of the Company at www.arvind.com. The Postal Ballot Notice along with Explanatory Statement is also available on website of BSE Limited (www.bseindia.com) and National Stock Exchange of India Limited (www.nseindia.com) ("Stock Exchanges") where the equity shares of the Company are listed; (4) Mr. Hitesh Bach, (CP No.: 8195), Proprietor, Hitesh Bach & Associates, Practising Company Secretaries has been appointed as Scrutinizer for conducting remote e-voting process in accordance with the law and in a fair and transparent manner; (5) For any queries/grievances, in relation to voting through electronic means, members may contact Registrar and Transfer Agent (RTA) i.e. Link Intime India Private Limited at arvind@linkintime.com, the Scrutinizer at psb.bhaskaras@nsdl.com or the Company at investor@arvind.in; (6) The result of the voting by Postal Ballot through remote e-voting shall be declared within 2 working days from the closure of e-voting. The results declared and the Scrutinizer's Report shall be made available at the Registered Office of the Company and on Company's website and on the website of NSDL at www.evoting.nsdl.com besides being communicated to the Stock Exchanges where the Company's shares are listed.

By order of the Board
For Arvind Limited

Sd/-
Krunal Bhan
Company Secretary
Membership No. A20162
18/06/2024

Place: Ahmedabad
Date: 18th June, 2024

ANNOUNCEMENT TO THE SHAREHOLDERS OF OASIS SECURITIES LIMITED
("OSL"/"OASIS"/"TARGET COMPANY"/"TC")
(Corporate Identification No. L51900MH1986PLC041499)

Registered Office: Raja Bahadur Compound, Building No. 5, 2nd Floor, 43, Tamarind Lane, Mumbai - 400023.
Phone No.: 022-40463500/01; Email id: admin@oasiscaps.com; Website: www.oasiscaps.com

This Advertisement is being issued by Navigant Corporate Advisors Limited, on behalf of Mr. Rajesh Kumar Sodhani (Acquirer 1), Mrs. Priya Sodhani (Acquirer 2) and Mr. Gyan Chand Jain (Acquirer 3) pursuant to regulation 18(7) of the Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011, as amended ("SEBI (SAST) Regulations") in respect of Open Offer ("Offer") for the acquisition up to 4,81,000 Equity Shares of Rs. 10/- each representing 26.00% of the net voting share capital of the Target Company. The Offer Opening Public Announcement pursuant to Detailed Public Statement ("DPS") and the Public Announcement ("PA") made by the Acquirers has appeared in Financial Express - English Daily (all editions), Jansatta - Hindi Daily (all editions), Mumbai Lakshadep - Marathi Daily (Mumbai edition) on 11th June, 2024.

- Acquirers has completed the dispatch of the Physical Letter of Offer on 05th June, 2024 to such shareholders whose email addresses were not registered with Target Company pursuant to regulation 18(2) of the Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011, as amended ("SEBI (SAST) Regulations")
- Various Letter of Offers are remaining undelivered. Hence it is to be reiterated that copy of the LOF is also available on the website of Securities and Exchange Board of India (SEBI), www.sebi.gov.in and also on the website of Navigant to the Offer, www.navigantcorp.com.
- Shareholders who have not received the Letter of Offer can tender the shares in accordance with procedure described in clause 8.15 on 24th of Letter of Offer, which is reproduced as below:

Procedure for Tendering the Shares in case of Non-Receipt of the Letter of Offer:

Persons who have acquired equity shares but whose names do not appear in the register of members of the Target Company on the identified date, or those who have not received the letter of offer, may also participate in this Offer. A shareholder may participate in the Offer by approaching their broker and tender equity shares in the Open Offer as per the procedure mentioned in this Letter of Offer or in the Form of Acceptance-cum-Acknowledgement. The Letter of Offer along with Form of Acceptance-cum-Acknowledgement will be dispatched to all the eligible shareholders of the Target Company as on the identified date. In case of non-receipt of the Letter of Offer, such eligible shareholders of the Target Company may download the same from the SEBI website (www.sebi.gov.in) or BSE website (www.bseindia.com) or Merchant Banker website (www.navigantcorp.com) or obtain a copy of the same from the Registrar to the Offer on providing suitable documentary evidence of holding of the Equity shares of the Target Company. Alternatively in case of non-receipt of the Letter of Offer, shareholders holding shares may participate in the Offer by providing their application in plain paper in writing signed by all shareholder, stating name, address, number of shares held, client ID number, DP name, DP ID number, number of shares tendered and other relevant documents such as physical share certificates and Form SH-4 in case of shares being held in physical form. Such Shareholders have to ensure that their order is entered in the electronic platform to be made available by the BSE before the closure of the Offer.

Capitalized terms used in this announcement, but not defined, shall have the same meaning assigned to them in the PA, DPS and LOF.

ISSUED BY MANAGER TO THE OFFER FOR AND ON BEHALF OF THE ACQUIRERS
MR. RAJESH KUMAR SODHANI, MRS. PRIYA SODHANI AND MR. GYAN CHAND JAIN

NAVIGANT CORPORATE ADVISORS LIMITED
804, Meadows, Sahar Plaza Complex, J B Nagar, Andheri Kurla Road,
Andheri East, Mumbai - 400059.
Tel No. +91 22 4120 4837 / 4973 5078; Email id: navigant@navigantcorp.com
Website: www.navigantcorp.com; SEBI Registration No: INM000012243
Contact person: Mr. Sarthak Vijjani

HSBC MUTUAL FUND NOTICE

Notice is hereby given that the Trustees of HSBC Mutual Fund have approved the declaration of dividends under the Income Distribution cum Capital Withdrawal (IDCW) option of the following scheme of HSBC Mutual Fund:

Sr. No.	Scheme/Plan Option	Quantum of Dividend (in ₹ per unit)	NAV of the IDCW Option (as on June 14, 2024) (in ₹ per unit)
1.	HSBC Arbitrage Fund - Regular Plan - Quarterly IDCW Option	0.22	11,2394
2.	HSBC Arbitrage Fund - Direct Plan - Quarterly IDCW Option	0.25	11,4784

Record Date: June 21, 2024. Face Value: Rs 10 per unit

The above dividend is subject to availability of distributable surplus and may be lower to the extent of distributable surplus available on the record date. Pursuant to payment of dividend, the NAV of the IDCW option of the above-mentioned schemes/ plans will fall to the extent of dividend distribution and statutory levy, if any.

All the unitholders of the above scheme whose names appear on the register of unitholders as on the record date will be eligible to receive the dividend.

For & on behalf of HSBC Asset Management (India) Private Limited
(Investment Manager to HSBC Mutual Fund)

Sd/-
Authorised Signatory
Mumbai, June 18, 2024

HSBC
Asset Management

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.
HSBC Asset Management (India) Private Limited, 9-11 Floors, NESCO IT Park, Building no. 3, Western Express Highway, Goregaon (East), Mumbai - 400 063, India.
Email: investor.line@mutualfunds.hsbc.co.in, Website: www.assetmanagement.hsbc.co.in
Customer Service Number - 1800 200 2426 / 1800 4100 200
Issued by HSBC Asset Management (India) Private Limited
CIN-U7140AM2000H1PTC134220

NAVIGANT

Place: Mumbai
Date: June 18, 2024

